

28 જૂન 2018

બ્રેમ્પટનના પ્રથમ પ્રાઈડ ઈન દ સ્ક્વેરની ઉજવણી
સીટી ગાર્ડન સ્ક્વેરમાં જુલાઈ 8 થી 12ના રોજ સાંજે 8 કલાકે પ્રાઈડ ઉજવણીનું આયોજન કરે છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો – જુલાઈ 8ના રોજ, પહેલી વખત ગાર્ડન સ્ક્વેરમાં પ્રાઈડ ઈન બ્રેમ્પટનની ઉજવણી કરો!

પ્રાઈડ ઈન દ સ્ક્વેર અપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે અને તેમાં સ્થાનિક અને રાષ્ટ્રીય કલાકારો, વક્તાઓ, ફેસ પેઈન્ટરો, બસ્કરો, સિટ્લ્ટ-વોકરો અને સામુદાયિક મેળાના રોમાંચક સંયોજન પરિવારિક અને મિત્રતાભર્યાં કાર્યક્રમો આપશે.

ઈવેન્ટનું આયોજન બ્રેમ્પટનના પોતાના ડેવિડ પિલ્લાઈ કરશે જેઓ લેખક, નિર્માતા અને મિડિયા પર્સનાલિટી છે. તેમની સ્વચ્છંદતાભરી વિનોદવૃત્તિ (તેમજ લાક્ષણિક બ્લેઝરો)થી એમણે તેમના અનોખાપણાથી રંગમંચને મુઠીમાં કર્યો છે.

આખી અપોર લાઈવ મનોરંજનની મજા માણજો. ફે એન્ડ ફ્લફી (Fay & Fluffy) દ્વારા ડ્રેગ સ્ટોરીટાઈમ (Drag Storytime) સાંભળજો, ડાયના (DIANA), અને કેનેડિયન મોલ્ડોક ગાયક-ગીતકાર શોનીને સાંભળજો, ઈલ નાના ડાઈવર્સસીટી ડાન્સ કંપની (Ill Nana DiverseCity Dance Company) અને ઈજી ક્વાન્ડિબેન્સ (EJ Kwandibens)ના કાર્યક્રમો માણજો, અને ડીજે રેગિના જેન્ટલી (DJ Regina Gently)ની ધુનોના સથવારે નૃત્યનો આનંદ માણજો. સ્થાનિક કલાકારોમાં સામેલ છે સોન્યા શોર્ટર (Sonya Shorter) અને આર ફ્લેક્સ (R. Flex).

કમ્યુનિટી ફેર એટલેકે સમુદાયના મેળામાં ઘણા બધાં સ્થાનિક જૂથો ભેગા મળશે જેઓ LGBTQ2IA+ સમુદાયને સેવા આપે છે. સમુદાયના વિવિધ જૂથો અને સેવાઓ વિશે જાણકારી મેળવવાની આ એક રોમાંચક તક પુરવાર થશે.

સાંજે 5 થી 8 વાગ્યે થનાર પાર્ટી ચૂકશો નહીં. ડીજે શીખ નોલેજ (DJ Sikh Knowledge) દ રોઝ પેટિઓ (The Rose Patio) પર કાર્યક્રમ આપશે જ્યાં બારની સેવા ઉપલબ્ધ રહેશે.

ગાર્ડન સ્ક્વેરમાં આ ખાસ દિનની ઉજવણીમાં તમામનું સ્વાગત છે! પ્રાઈડ ઈન દ સ્ક્વેર વિશે વધુ જાણવા અને ગાર્ડન સ્ક્વેરના કાર્યક્રમો વિશે સંપૂર્ણ વિગતો માટે અહીં મુલાકાત લો www.brampton.ca/gardensquare

ક્વોટ:

"બ્રેમ્પટન આપણા શહેરના તાણા વાણાનો ભાગ છે તેવા તમામ અનન્ય સમુદાયો માટે સમાવેશક છે અને તેમનું સ્વાગત કરે છે. સીટીની પ્રથમ પ્રાઈડ ઉજવણીનું આયોજન કરતા અમને ગર્વની લાગણી થાય છે અને અમે આપણા નાગરિકો અને મુલાકાતીઓને જુલાઈ 8ના રોજ ગાર્ડન સ્ક્વેરમાં હાજર રહેવા નિમંત્રણ આપીએ છીએ"

- મેયર લિન્ડા જેફી

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.